

RAN-2501001205027702 / 2601000105022303
B.A. (Sem. V) Examination March - 2026
Economics (Paper - 13) Major : Economics of Growth and Development
[Total Marks: 50

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book. (2) પ્રશ્ન ૧ ફરજિયાત છે. Question No. 1 is compulsory. (3) જમણી બાજુના અંક પ્રશ્નના ગુણ દર્શાવે છે. Figures of the right indicate full marks of the questions.	Seat No.: Student's Signature
---	--

- પ્ર. 1 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો(કોઈપણ પાંચ) (10)**
- 1) જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું ?
 - 2) શ્રમની ગતિશીલતા માટે કયા પરિબલો કારણભૂત છે.
 - 3) એડમસ્મિથે આપેલું ઉત્પાદન વિધેય જણાવો.
 - 4) આર્થિક મોડેલ ની કોઈપણ ચાર ધારણાઓ જણાવો.
 - 5) આર્થિક વિકાસ એટલે શું?
 - 6) શ્રમવિભાજન એટલે શું?
 - 7) માર્શલે આપેલી સ્થિર સમાજની વિભાવના રજૂ કરો.
- પ્ર. 2 આર્થિક વૃદ્ધિ એટલે શું ? આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત સમજાવો. (13)**
- અથવા**
- અ) અવિરત વિકાસ ક્ષમતાનો ખ્યાલ સમજાવો. (6)
 - બ) માનવ ગરીબી સુચક આંક (7)
- પ્ર. 3 રિકાર્ડોના આર્થિક વૃદ્ધિના સિદ્ધાંતની સમજૂતી આપો. (13)**
- અથવા**
- અ) આર્થિક મોડેલની ઉપયોગીતાની ચર્ચા કરો. (6)
 - બ) માનવ વિકાસના ઘટકોની ચર્ચા કરો. (7)
- પ્ર. 4 ટૂંક નોંધ લખો (ગમે તે બે) (14)**
- 1) મહાલનોબીસ ભારતીય યોજના મોડેલ
 - 2) માનવ સુખાકારી આંક
 - 3) મૂલ્ય નિર્ધારણમાં સમયના તત્વનું મહત્વ
 - 4) આર્થિક મોડેલના પ્રકારો સમજાવો.

ENGLISH VERSION

- Q. 1** **Answer the following questions briefly (Any Five)** **(10)**
- 1) What is the Physical quality of life Index?
 - 2) Which are the factors responsible for the mobility of labour?
 - 3) State the production function given by Adam Smith.
 - 4) State any four assumptions of the economic model.
 - 5) What is Economic Development.
 - 6) What is division of labour ?
 - 7) Present the concept of stable society given by Marshall.
- Q. 2** What is economic growth? Explain the difference between economic growth and economic development. **(13)**
- OR**
- Q. 2** a) Explain the concept of continuous growth potential. **(6)**
 b) Human Poverty Index. **(7)**
- Q. 3** Explain Ricardo's theory of economic growth. **(13)**
- OR**
- Q. 3** a) Discuss the usefulness of economic models. **(6)**
 b) Discuss the components of human development. **(7)**
- Q. 4** **Write short notes (any two)** **(14)**
- 1) 'Mahalanobis' Indian Planning Model
 - 2) Human Well-being Index
 - 3) Importance of time element in value determination
 - 4) Explain the types of economic models
-